

PART PLAN SHOWING

BLOCK NO :- 521

VILLAGE:- BOPAL

TALUKA:- DASKROI

DISTRICT:- AHMEDABAD

LEGEND

 Residential Zone II-R2

 RESIDENTIAL AFFORDABLE HOUSING ZONE-RAH

 Existing Road


 Proposed Road

 TPS Boundary



1 cm = 80.00 mt


Part Plan of Sanctioned Development plan (Second Revised) of AUDA Under Govt. Notification no . GH/V/207 of 2014/DVP-112013-4777-L Dated-20/12/2014 U/S -17(1)(c) of the G.T.P.& U.D. Act-1976



This part plan is certified for the BLOCK NO :- 521

NOTE :- This part plan cannot be used for making any entry in revenue records and can not be considered as Development Permission or Permission for Addition/Alteration.

Prep. By: 


Chd. By: 

H. D' man:

Date: 29-09-2020

Receipt NO :- 180

TRUE COPY


Assistant Town Planner
Ahmedabad Urban Development Authority
Ahmedabad.



અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ

સરદાર વલ્લભભાઈ પટેલ ભવન, આશ્રમ રોડ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪.
ફોન નં.: ૨૭૫૪૫૦૫૧, ૨૭૫૪૫૦૫૨, ૨૭૫૪૫૦૫૪



ઔડાની વેબ સાઈટ : www.auda.org.in

- ઔડાની વિકાસ યોજના.
- માળખાકીય સુવિધાઓ. (INFRASTRUCTURE)
- સામાજિક સેવાઓની યોજનાઓ.

હવે વિવિધ માહિતી ઉપલબ્ધ છે, - જેવી કે...
નગર રચના યોજનાઓ. (ટી.પી.સ્કીમ)
પર્યાવરણલક્ષી યોજનાઓ
અન્ય પ્રોજેક્ટ

અરજી નંબર _____
પહેલો નંબર ૫૫૦

ઝોનીંગ સર્ટીફિકેટ

તા. ૨૬-૦૮-૨૦૨૦

પ્રતિ શ્રી, ચિલાય શેઠાસી
અમદાવાદ

વિષય : વિકાસ યોજના ૨૦૨૧ ના ઝોનીંગ સર્ટીફિકેટ અંગે.
સંદર્ભ : આપશ્રીની તા. ૨૬-૦૮-૨૦૨૦ ની અરજી અન્વયે

ઉપરોક્ત વિષયે મોજે ચિલાય તાલુકો દસકીઈ બ્લોક નં./સર્વે નં. ૫૨૧
ની જમીન

ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ ની કલમ ૧૭ (૧) (ક) હેઠળ તા. ૨૦-૧૨-૨૦૧૪ ના રોજ
રાજ્ય સરકાર શ્રી એ મંજૂર કરેલ દ્વિતીય પુનરાવર્તીત વિકાસ નકશાની દરખાસ્ત મુજબ સદરહું જમીનમાંથી _____

ના રોડની કપાત થાય છે. બાકીનો ભાગ ડેસકીઈ-૨ બ્લોક/અમદાવાદ શહેર, ડેસકીઈ-૨ બ્લોક હાઉસિંગ કોન-૨૪૫

ઝોનમાં આવે છે.

૧. સદરહું જમીન ચિલાય ટી.પી. સ્કીમ નં ૩ (પ્રાચીનિક ધોળા)

તથા _____ ના વિસ્તારમાં આવતી હોવાથી
તેને ટી.પી. સ્કીમ હેઠળ અન્ય દરખાસ્તો - જોગવાઈઓ ફેરફાર ને બંધનકર્તા રહેશે.

૨. દ્વિતીય પુનરાવર્તીત વિકાસ યોજનાની દરખાસ્તો સરકાર શ્રી ને આધીન ફેરફારને પાત્ર રહેશે.

નોંધ : “આ ફક્ત ઝોનીંગ સર્ટીફિકેટ છે
બાંધકામની પરવાનગી નથી”

CHD BY
HD MAN



મદદનીશ નગર નિયોજક
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ
અમદાવાદ

PART PLAN OF PRELIMINARY
TOWN PLANNING SCHEME NO:3 (BOPAL)

FINAL PLOT NO: 182


ORIGINAL PLOT NO: —



SCALE 1CM=20.00M

LEGEND

- O.P BOUNDARY
— F.P BOUNDARY



This part plan is certified for the F.P NO:182

Sanctioned The Preliminary,
Under Govt. Notification U. D. and U. H. D.
NO. GH/V/288 OF 2017/TPS-112015- 3552-L; Dt:23-10-2017.

NOTE:—Final plots boundary and allotment of final plot as subject to variation
This part plan cannot be used for making any entry in revenue records
and can not be considered As Development Permission
or Permission for Addition/Alteration.

TRUE COPY

Prep. By

Chd. By

H. D' man:

Assistant Town Planner
Ahmedabad Urban Development Authority
Ahmedabad.


ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬

ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ નિયમો-૧૯૭૮

નગર રચના યોજના નં. ૩ (બોપલ) પ્રારંભિક યોજના તા ૨૩ ૧૦ ૨૦૧૭

પુનઃ વહેંચણી પત્રક

અનુ. નંબર	માલિકનું નામ		સત્તા પ્રકાર	બ્લોક નંબર	મુળખંડ		અંતિમખંડ		નોંધ
					નંબર	ક્ષેત્રફળ ચો.મી.	નંબર	ક્ષેત્રફળ ચો.મી.	
1	2			૪	5	6	7	8	9
૧૬૦	૧	આનંદ દર્શન કો.ઓ.હા.સો.લી.	(જુ.શ.)	521	182	5160	182	4128	(૧) જમીન માલિકોના હકક-હિસ્સા અંતિમખંડમાં તેમની મુળખંડની
			(ખે.સિ.)						જમીનમાંનાં હકક-હિસ્સાનાં પ્રમાણમાં રહેશે.




CHD.BY:

H'D.MAN:

29-09-2020

12:01



TRUE COPY

ASSISTANT TOWN PLANNER
AHMEDABAD URBAN DEVELOPMENT AUTHORITY
AHMEDABAD